

ત્વરિત જાહેરાત માટે

## પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન રજૂ કરે છે લાઇવ મ્યુઝિક, થિએટર અને સાંસ્કૃતિક કાર્યક્રમોની આખા ઓગસ્ટ માસમાં ભરમાર

બ્રેમ્પટન, ઓન્ટારિઓ (12 ઓગસ્ટ 2022) -- સિટી ઓફ બ્રેમ્પટન લાઇવ મ્યુઝિક રંગમંચનું મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા રોમાંચિત છે જેમાં તમામ લોકો ગાર્ડન સ્ક્વેર તેમજ ૬ રોઝ બ્રેમ્પટન ખાતે આનંદ માણશે.

પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન નીચે મુજબના કાર્યક્રમો યોજી રહ્યા છે:

### સ્ટોમ્પ એન સ્ટેમ્પીડ – ઓગસ્ટ 13, સાંજે 4 થી 8 વાગ્યા સુધી, ગાર્ડન સ્ક્વેર બ્રેમ્પટન

પોતાની કાઓબોય હેટ અને બૂટ્સ લઈને અને પોતાના ડાન્સિંગ પાર્ટનરને લઈને પણ પધારી શકો છો!

સ્ટોમ્પ 'એન સ્ટેમ્પીડ (Stomp 'N Stampede) ફરી આવી રહ્યો છે ગાર્ડન સ્ક્વેરમાં ઓગસ્ટની 13મીએ જેથી દરેક તળપટ્ટી વસ્તુઓનો આનંદ લઈ શકાય! મુખ્ય કલાકાર નિકોલ રે (Nicole Rayy) સાથે DJ જોલની રિવેક્સના લાઇવ સ્પિનિંગને માણો. તે ઉપરાંત, ડબલ ટ્રબલ લાઇવ ડાન્સરોના નૃત્યના લાઇવ ડાન્સિંગના પાઠ તો બિલકુલ ચુકવા જેવા નથી.

### અક્રોસ ઇ પોપ્સ – ઓગસ્ટ 25 સાંજે 8 વાગ્યે, ૬ રોઝ બ્રેમ્પટન

લિસા વે (Leisa Way)ને સાંભળશો અને જબરદસ્ત પ્રતિભા ધરાવતા 5-પિસ લોનલી હાર્ટ્સ ક્લબ બેન્ડ હશે જેઓ તમને લઈ જશે એક ચમકારા ભર્યા સંગીતમય પ્રવાસ પર. ઈતિહાસનું એક પાનું ફરી જીવંત થશે જ્યારે બ્રિટિશ પોપ મ્યુઝિકનું "અક્રોસ ઇ પોપ્સ" રજૂ થશે અને જેને માટે ચાર લિવરપૂલના મોપ-હેડેડ છોકરાઓનો માનવો રહ્યો જેમણે લોકપ્રિયતાનો એવો ઉન્માદ ઊભો કર્યો જેનો જોડ નથી. ઉત્તર અમેરિકામાં તો એનો જુવાળ એવો પ્રસર્યો કે તેને "બ્રિટિશ આક્રમણ"નું લાડકું નામ અપાયું જે શરૂ થયું એક એવા શબ્દથી જે કહેવાયું "બિટલમેનિયા"!

અક્રોસ ઇ પોપ્સ બ્રિટિશ પોપ અને રોક મ્યુઝિકના 50 વર્ષને વધાવી લે છે જેમાં સામેલ છે 60ના દાયકાના હિટ ગીતો અને આજના સૌથી મોટા સ્ટાર્સ જે સંગીતની શાહી પરંપરાને સલામી આપે છે જેમકે: ઇ બિટલ્સ, ઇ રોલિંગ સ્ટોન્સ, એલ્ટન જોલન, ટોમ જોન્સ, એલ્વિસ કોસ્ટેલો, ઇ હૂ, સિંટિંગ અને ઇ પોલિસ; એની લેનોક્સ, ઇ કિક્સ અને બીજા કેટલાયે બધા! ગમ્મતભરી રાત માટે પોતાના ડાન્સિંગ શૂઝ ચડાવી લો અને આ સ્પેશિયલ હિટ કન્સર્ટમાં આવો જે બિલકુલ ચુકવા જેવો નથી!

### મોનસૂન સાઉન્ડ્સ -- ઓગસ્ટ 27 સાંજે 7 વાગ્યે, ૬ રોઝ બ્રેમ્પટન લોબી

પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટનને એવા સમુદાયની સેવા કરવાનો ગૌરવ છે જેમાં 44.3 ટકા રહેવાસીઓ દક્ષિણ એશિયાઈ વંશના છે. આવા મનોહર પયરંગીપણામાં વિકસતા યુવાન દક્ષિણ એશિયાઈ સમુદાયો નવા અવાજો અને અભિવ્યક્તિના નવા સ્વરૂપો સાથે ઉભરી રહ્યા છે. Noyz દ્વારા ક્યુરેટ કરવામાં આવનાર નિઃશુલ્ક દક્ષિણ એશિયાઈ હિપ હોપ ફેસ્ટિવલમાં વિવિધ સંસ્કૃતિઓનું અનન્ય મિલન જોઈ શકાશે જ્યાં દક્ષિણ એશિયાઈ હિપ હોપનો ઉદય થયો હોય, જ્યાં પરંપરાગત ભાંગડાના ધ્વનિ ઘણી વખત ક્લાસિક બૂમ-બાપથી માંડીને લીરસા જાઝ-રેપથી ટ્રેપ બીટ્સ સુધીના પ્રકારો સાથે જાણે આલિંગનમાં જકડાઈ જાય, જેમાં ભાગ લેશે:

- શીખ નોલેજ અને હે બોમ્બે
- DJ રોશની
- સિદ્ધર્થ
- કેરાલંકા
- તનવીર રોઝ
- સિપટી

### સપ્ટેમ્બરમાં આગમન

#### ફ્લો ફેસ્ટ - સપ્ટેમ્બર 17, સાંજે 7:30 વાગ્યે, ૬ રોઝ બ્રેમ્પટન

પહેલવહેલા ફ્લો ફેસ્ટ, બ્રેમ્પટન ઇન્ટરનેશનલ ડ્રમિંગ ફેસ્ટિવલમાં તમારા દિલોની ધડકનને ધડકવા દો! આ રોમાંચક સાંજે મનોરંજન પીરસશે મુખ્ય કલાકારો ૬ લારનેલ લુઈસ બેન્ડ (The Larnell Lewis Band) અને ૬ જોય લૅપ્સ પ્રોજેક્ટ (The Joy Lapps Project). ગ્રેમી એવોર્ડ વિજેતા બ્રેમ્પટનના સપૂત સંગીતકાર, ગીતકાર અને શિક્ષણવિદ લારનેલ લુઈસ અને ગ્રેમી એવોર્ડ નિયુક્ત સંગીતકાર, ગીતકાર અને શિક્ષણવિદ જોય લૅપ્સ, આફ્રો-કેરિબિઅન અને જાઝ એન્સેમ્બલ્સના સંગીતમય ક્યુઝનને દોરશે જે ચોક્કસ જ પ્રેક્ષકોના હૃદય એકસાથે ધડકાવશે.

ડાન્સ, ડ્રમ અને નગોમા (Ngoma) સાથે પર્ટી કરો જે કેનેડાનું ટોચનું યુવા દોરવણી લેકળનું એન્સેમ્બલ છે. અને રાત અભિ બાકી હે - DJ જોશુઆ લ્યુકાસ, રોમિંગ મ્યુઝિકલ એન્સેમ્બલ્સ, ખાણીપીણી, આર્ટ પ્રદર્શન અને બીજું ઘણું બધું જેનાથી પ્રેક્ષકો ડ્રમિંગ, મ્યુઝિક અને દુનિયાભરના સંગીતના સુરોભરી સાંજમાં ડૂબી જશે.

પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટનના નિર્ધારિત કરેલા કાર્યક્રમો વિશેની વધુ જાણકારી [અહીંથી](#) જાણો.

### સુવાક્યો

"પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન લાઈવ મ્યુઝિકની જોરદાર લાઈન અપ, થએટર અને રહેવાસીઓ તેમજ મુલાકાતીઓ માટે સાંસ્કૃતિક અનુભવો રજૂ કરવા ચાલુ રાખે છે જે તેઓ છેક સપ્ટેમ્બર સુધી માણી શકશે! ચોક્કસપણે તમામ નક્કી કરેલા કાર્યક્રમોના સમયપત્રક જોતા રહેશો અને ઉનાળાના બાકી રહેલા સપ્તાહ માટેના આયોજનો કરતા રહેશો. અહીં બધા માટે કંઈકને કંઈક માણવા માટે હાજર છે."

- પૉટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રમ્પટન રહેવાસીઓ અને મુલાકાતીઓ માણી શકે એવા અનુભવો રજૂ કરતા રહેશે! બ્રમ્પટન પર્યટની ફલક છે અને આપણા સાંસ્કૃતિક અનુભવો આપણા સમુદાયોને સમૃદ્ધ કરે છે. હું બધાને આ અજોડ સંગીતમય અને મનોરંજક કાર્યક્રમોમાં હાજર રહેવા પ્રોત્સાહિત કરું છું!"

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; કમ્યુનિટી સર્વિસિસ, સીટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ , અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)